

NOTICE TO PUBLIC

I Sushma Tiwari W/o Satish Chandra Tiwari R/O 201 Sapna Apartment 87 Indrapuri Indore M.P. 452001 have lost/misplaced share certificate of ICICI Bank Limited 250 Share, Certificate No.90245, Distinctive No.25134851-25135100 I had applied for issue duplicate share certificate of above if any one hold the certificate or have any objection for issuing duplicate certificate to me, please contact the company at ICICI Bank Tower, Near Chakli Circle, Old Padra Road, Vadodara-390 007, Gujarat, or me also, the company will not be responsible for any loss/damage occurring thereby if no objection is received by the company or me within 10 days from the date of publication of this notice the company will be process to issue me duplicate share certificate of ICICI Bank Limited Place : Indore, Date : 07.02.2020

HIMADRI CREDIT & FINANCE LIMITED

23A, Netaji Subhas Road, 8th Floor, Kolkata - 700 001
CIN: L65921WB1994PLC062875
Website: www.himadricredit.in email: hcf@himadri.com

Notice of Board Meeting

Notice pursuant to Regulation 47(1)(a) of the SEBI (LODR) Regulations, 2015 is hereby given that the meeting of the Board of Directors of Himadri Credit & Finance Limited is scheduled to be held at its corporate office at "Ruby House", 8, India Exchange Place, 2nd Floor, Kolkata - 700001 on Friday, 14 February 2020 at 3.00 p.m., inter-alia to consider and take on record the Un-audited Financial Results for the quarter and nine months ended 31 December 2019.

This notice shall also be available on the Company's website at: www.himadricredit.in

For Himadri Credit & Finance Ltd

Place : Kolkata
Date : 6 February 2020
Koushik Ranjan Saha
Company Secretary

ASI Industries Ltd.

(Formerly known as Associated Stone Industries (Kotah) Limited)
CIN:L14101MH1945PLC256122
Regd. Off: Marathon Innova, A Wing 7th Floor, Off: Ganpatrao Kadam Marg, Lower Parel, Mumbai 400013, Maharashtra. Web Site : asigroup.co.in
Email: investors@asigroup.co.in, Tel :022-40896100, Fax : 022-40896199

NOTICE

Pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation 2015, Notice is hereby given that the Meeting of the Board of Directors of the Company will be held on Friday, 14th February, 2020, inter alia, to consider and to take on record the Consolidated and Standalone Unaudited Financial Results for the quarter and nine months ended 31st December, 2019.

For ASI Industries Ltd

Place : Mumbai
Date : 04.02.2020
Manoj Jain
Company Secretary

The Notice is also available at Investors section of the Company's website: asigroup.co.in and corporate announcement section of BSE website: www.bseindia.com

SAMBHAV MEDIA LIMITED

(CIN: L67120GJ1990PLC014094)
Registered Office: "Sambhav House", Opp. Judges' Bungalows, Premchandnagar Road, Satellite, Ahmedabad - 380 015
Phone: +91 79 2687 3914/15/16/17 Fax: +91 79 2687 3922
Email: secretarial@sambhav.com Website: www.sambhav.com

NOTICE

Notice, pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, is hereby given that a Meeting of Board of Directors of the Company will be held on Friday, February 14, 2020 at the Registered Office of the Company to consider and approve the unaudited financial results (standalone & consolidated) for the quarter/ nine months ended on December 31, 2019.

You may also refer the website of the Company at www.sambhav.com and stock exchange(s) at www.bseindia.com and www.nseindia.com for further details.

Date: February 06, 2020 For, Sambhav Media Limited
Place: Ahmedabad Company Secretary

M/s DANKE ELECTRICALS LIMITED - IN LIQUIDATION

Liquidator Address: M-19-21, Metro Tower, Ring Road, Surat, Gujarat, India
Email: jlnusco@gmail.com; ipsunilkabra@gmail.com

E-AUCTION SALE NOTICE

Notice is hereby given to the public in general under the insolvency and Bankruptcy Code, 2016 and regulation there under, that the properties stated in Table given below, will be sold by E-auction through the service provider M/s E-procurement Technologies Limited (Auction Tiger) via website https://ncltauction.auctiontiger.net

Date and Time of Auction Thursday, 27.02.2020 11 AM to 2 PM
Last Date for Submission of EMD Tuesday, 25.02.2020 before 06:00 PM
Inspection Date & Time Friday, 21.02.2020 From 10:00 AM to 5:00 PM
Contact person (Mr. Vaibhav Prabhudesai : +91- 84605-19752)

Sl. No.	ASSET LOCATION/ DETAILS OF FINANCIAL ASSETS	Location	Reserve Price (Rs.)	Earnest Money Deposit (Rs.)
1	Factory Land and Building at Plot No. 659, Waghadia Industrial Estate (GIDC), Near Sanghvi Forging, Gate No. 1, Waghadia, Vadodara.	Vadodara	1,12,11,000	11,21,100
2	Factory Land and Building at Plot No. 776 to 781, Waghadia Industrial Estate (GIDC), Near Sanghvi Forging, Gate No. 1, Waghadia, Vadodara.	Vadodara	4,89,40,000	48,94,000
3	Plant & Machinery (7 number of Cranes only) installed at factory premises mentioned at Sl. No. 2	Vadodara	35,68,000	3,56,800
4	Financial Assets & Securities (1,86,723 Equity Shares of Danke Techno Electro Private Limited)	Vadodara	50,49,000	5,04,900
5	Financial Assets & Securities (22,00,898 Preference Shares of Danke Techno Electro Private Limited)	Vadodara	86,49,000	8,64,900

The EMD(Refundable) shall be payable by interested bidder through NEFT/RTGS/Demand Draft on or before 25.02.2020 in Bank A/c of "Danke Electricals Limited- in liquidation" having A/c No.01950200002996 and IFSC Code IOBA000195 with Indian Overseas Bank. For detail terms and condition of E-auction sale, refer Sale Notice available on https://ncltauction.auctiontiger.net. For any query regarding E-auction, contact Mr. Pushpit Maru at +91-7961200581/584/586/594/554, E-mail id pushpit@ncltauction.auctiontiger.net

Date: 07.02.2020 Liquidator in the matter of M/s Danke Electricals Limited
Place: Surat IBI Reg. No: IBB/PA-001/IP-P01011/2017-18/11662

RESONANCE SPECIALTIES LIMITED

(CIN No. L25209MH1989PLC051993)
REGD. OFFICE : 301, EVERSHINE MALL, OFF LINK ROAD, MALAD (WEST), MUMBAI 400064
Website: www.resonancespecialties.com TEL: 022 42172222 Email: info@resonancespecialties.com

FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 31ST DECEMBER, 2019 (Rs. in Lakhs)

Sr. No.	Particulars	Quarter Ended			Nine Month Ended		Year Ended
		31st December, 2019	30th September, 2019	31st December, 2018	31st December, 2019	31st December, 2018	31st March, 2019
1	Total Income from operations	1,624.81	1,148.57	1,331.84	4,431.60	2,596.90	4,162.94
2	Net Profit / (Loss) for the period (Before Tax, Exceptional and/or Extra ordinary items)	345.25	60.69	149.65	696.33	112.38	484.34
3	Net Profit / (Loss) for the period (before Tax, after Exceptional and/or Extra ordinary items)	345.25	60.69	149.65	576.72	145.11	482.67
4	Net Profit / (Loss) for the period (after Tax, after Exceptional and/or Extra ordinary items)	345.25	60.69	149.65	576.72	145.11	475.85
5	Comprehensive income for the period (Comprising profit & loss) for the period (after tax) and other comprehensive income (after tax)	241.14	44.25	110.52	424.76	96.87	320.42
6	Equity Share Capital	1,154.40	1,154.40	1,154.40	1,154.40	1,154.40	1,154.40
7	Reserves (Excluding Revaluation reserve as shown in the Audited Balance sheet of the previous year)	1,354.09	1,112.95	705.41	1,354.09	705.41	929.33
8	Earning per Shares (of Rs 10/- each) (for continuing and discontinued operations) - (Basic & Diluted)	2.09	0.38	0.96	3.68	0.84	2.78

Notes:
1 The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the websites of the Stock Exchange(s) and the listed entity.
2 The above unaudited Results, as reviewed by the Audit Committee, have been approved by the Board of Directors at their meeting held on 06th February 2020
3 As informed by M/s Adroit Corporate Services Pvt. Ltd., Registrar and Share Transfer Agents of the Company, there were no investors' complaints pending since last quarter. The company has not received any new complaints during the quarter.
4 Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules.
5 In accordance with Ind AS-108 "Operating Segments" the company has only one reportable primary business segment i.e. "Chemical Manufacturing". However, the company has secondary geographical segment which is disclosed in financial statements as per Ind AS-108.

Information about secondary geographical segments as per financial statements

Particulars	Amt
Segment Revenue	
- India	151,194,921
- Outside India	291,965,421
Total	443,160,342

By the order of the Board
For RESONANCE SPECIALTIES LIMITED
Sd/-
Mrs. Archana Yadav
Chairperson & Director
DIN: 07335198

Place : Mumbai,
Date : 6th Feb 2020

NOTICE

Notice is hereby given that a meeting of the Board of Directors of the Company will be held on Friday, February 14, 2020 at Ernakulam to consider the proposal of payment of Interim Dividend for the Financial Year 2019-20, apart from other agenda items.
Notice of the aforesaid meeting is available on the Company's website, www.vguard.in and on the website of National Stock Exchange of India Limited, www.nseindia.com and BSE Limited, www.bseindia.com.

By Order of the Board
For V-GUARD INDUSTRIES LIMITED
Sd/-
Jayasree K
Company Secretary

Place: Ernakulam
Date : 07.02.2020
V-GUARD INDUSTRIES LIMITED., Regd. Office: 42/962, Vennala High School Road, Vennala PO, Ernakulam - 682 028, Kerala, India. I Ph: 0484-4335000. E-mail: mail@vguard.in Website: www.vguard.in I CIN: L31200KL1996PLC10010

HARISH TEXTILE ENGINEERS LIMITED

2nd Floor, 19 Parsi Panchayat Road, Andheri (East), Mumbai-400069
CIN No: U29119MH2019PLC201521 Web site: www.harishtextile.com

NOTICE

Pursuant to regulation 29 read with regulation 47 of the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015, Notice is hereby given that a meeting of the Board of Directors of the Company will be held on Friday, February 14, 2020 at the Registered office of the Company at 2nd Floor, 19 Parsi Panchayat Road, Andheri (East), Mumbai-400069, inter-alia to consider and take on record the Un-audited Financial Results for the quarter ended on December 31, 2019 and for any other matter as may be desired by the Board.

The Company shall intimate to the exchanges the Un-audited Financial Results upon the conclusion of the aforesaid Board Meeting and will arrange for the announcement of the same in the press and on the Company's website as required under SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015.

By order of the Board of Directors
For Harish Textile Engineers Limited

Place : Mumbai
Date : 05th February, 2020
Sandeeep Gandhi
Managing Director
DIN: 00941665

PRIME FOCUS LIMITED

Registered Office: Prime Focus House, Linking Road, Opp. Citi Bank, Khar (West), Mumbai - 400 052 • Phone: 022- 6715 5000 • Fax: 022- 6715 5001
• Website: www.primofocus.com • Email id: t.inidia@primofocus.com
• CIN: L92100MH1997PLC108981

NOTICE

Notice is hereby given that in terms of Regulation 29, 33 and 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, Meeting of the Board of Directors of the Company is scheduled to be held on Friday, February 14, 2020, inter-alia to consider, approve and take on record Un-audited Financial Results (Standalone & Consolidated) of the Company for the quarter and nine months ended December 31, 2019. Further, as per the SEBI (Prohibition of Insider Trading) Regulation, 2015 the trading window for dealing in securities of the Company which is currently closed shall open 48 hours after the declaration of Un-audited Financial Results for the quarter and nine months ended December 31, 2019.

The notice is also available on the website of the Company www.primofocus.com and that of BSE Limited www.bseindia.com and National Stock Exchange of India Limited www.nseindia.com.

By order of the Board,
For Prime Focus Limited

Place : Mumbai
Date : February 6, 2020
Parina Shah
Company Secretary

Business Standard

AHMEDABAD EDITION

Printed and Published by Himanshu S Patwa on behalf of Business Standard Private Limited and printed at M/S Bhaskar Printing Press, Survey No 148-P Near Nagdevta Mandir, Bavla Highway, Sanand Dist. Ahmedabad and published at Office No. 207, Sakar-II, Ashram Road, Ahmedabad-380006

Editor : Shyamal Majumdar

RNI NO. GUJENG/2001/4577

Readers should write their feedback at feedback@bsmail.in
Ph. 079-26577772, Fax: +91-79-26577728

For Subscription and Circulation enquiries please contact:
Ms. Mansi Singh
Head-Customer Relations
Business Standard Private Limited,
H/4 & 1/3, Building H, Paragon Centre, Opp. Birla Centurion, PB.Marg, Worli, Mumbai - 400013

E-mail: subs_bs@bsmail.in
"or sms, SUB BS to 57007"

DISCLAIMER News reports and feature articles in Business Standard seek to present an unbiased picture of developments in the markets, the corporate world and the government. Actual developments can turn out to be different owing to circumstances beyond Business Standard's control and knowledge. Business Standard does not take any responsibility for investment or business decisions taken by readers on the basis of reports and articles published in the newspaper. Readers are expected to form their own judgement. Business Standard does not associate itself with or stand by the contents of any of the advertisements accepted in good faith and published by it. Any claim related to the advertisements should be directed to the advertisers concerned. Unless explicitly stated otherwise, all rights reserved by M/s Business Standard Pvt. Ltd. Any printing, publication, reproduction, transmission or dissemination of the contents, in any form or by any means, is prohibited without the prior written consent of M/s Business Standard Pvt. Ltd. Any such prohibited and unauthorised act by any person/legal entity shall invite civil and criminal liabilities.

No Air Surcharge

SAFARI INDUSTRIES (INDIA) LIMITED

CIN: L25200MH1980PLC022812

Registered Office : 302-303, A Wing, The Cube, CTS No 1498, A/2, M V Road, Marol, Andheri (East), Mumbai - 400059. | (T) +91 22 40381888; (F) +91 22 40381850
Email id: investor@safarin.in | Website: www.safaribags.com

**EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31ST DECEMBER, 2019**

Sr. No.	Particulars	Consolidated		
		Quarter ended 31-Dec-2019	Nine months ended 31-Dec-2019	Corresponding quarter ended 31-Dec-2019
1	Revenue from Operations	16,611.25	54,146.91	14,654.07
2	Net Profit for the period (before tax, Exceptional and/or Extraordinary items)	1,267.04	3,495.80	801.11
3	Net Profit for the period before tax (after Exceptional and/or Extraordinary items)	1,267.04	3,495.80	801.11
4	Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary items)	950.45	2,597.95	501.86
5	Total Comprehensive Income for the period (Comprising profit for the period (after tax) and Other Comprehensive Income (after tax))	923.84	2,518.13	489.08
6	Paid-up Equity Share Capital	447.10	447.10	446.27
7	Earnings Per Share (Face value of Rs. 2/- each) (in Rs.)-			
	(a) Basic:	4.25	11.63	2.25
	(b) Diluted:	4.25	11.61	2.24

Notes:
1. Additional information on standalone unaudited financial results is as follows:

Sr. No.	Particulars	Standalone		
		Quarter ended 31-Dec-2019	Nine months ended 31-Dec-2019	Corresponding quarter ended 31-Dec-2019
1	Revenue from Operations	16,523.55	53,805.05	14,527.49
2	Profit before Tax	1,231.74	3,475.97	791.96
3	Profit after Tax	914.94	2,577.91	496.06

2. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange websites viz. www.bseindia.com and www.nseindia.com and on the company's website viz. www.safaribags.com.

For SAFARI INDUSTRIES (INDIA) LIMITED

Date : 05th February, 2020
Place : Mumbai

Sudhir Jatia
Chairman & Managing Director
DIN : 00031969

SHYAM CENTURY FERROUS LIMITED

CIN: L27310ML2011PLC008578

Regd. Office : Vill.: Lumshnong, PO: Khaliehriat, Dist. East Jaintia Hills, Meghalaya - 793210

Phone: 0365-278215, Fax: (033)22483539

Email: investors@shyamcenturyferrous.com; website: www.shyamcenturyferrous.com

Extract of Unaudited Financial Results for the Quarter/Nine months ended 31st December, 2019

Particulars	STANDALONE						CONSOLIDATED					
	Quarter ended		Nine months ended		Year ended	Quarter ended		Nine months ended		Year ended		
	31.12.2019 (Unaudited)	30.09.2019 (Unaudited)	31.12.2018 (Unaudited)	31.12.2019 (Unaudited)	31.12.2018 (Unaudited)	31.03.2019 (Unaudited)	31.12.2019 (Unaudited)	30.09.2019 (Unaudited)	31.12.2018 (Unaudited)	31.12.2019 (Unaudited)	31.03.2019 (Unaudited)	
Total Income from Operations	1,630.65	2,534.38	3,890.15	5,519.21	10,586.71	13,443.78	1,630.65	2,534.38	3,890.15	5,519.21	10,586.71	13,443.78
Net Profit/(Loss) for the period (before tax, exceptional items and or extraordinary items)	(90.78)	(231.83)	588.98	(581.02)	1,580.16	1,479.38	(90.78)	(231.83)	588.98	(581.02)	1,580.16	1,479.38
Net Profit/(Loss) for the period (before tax, after exceptional items and or extraordinary items)	(90.78)	(231.83)	588.98	(581.02)	1,580.16	1,479.38	(90.78)	(231.83)	588.98	(581.02)	1,580.16	1,479.38
Net Profit/(Loss) for the period (after tax, exceptional items and or extraordinary items)	(66.43)	(178.07)	413.69	(423.28)	1,114.60	1,048.01	(66.43)	(178.07)	413.69	(423.28)	1,114.60	1,048.01
Net Profit/(Loss) after tax and share of profit/(loss) of associate	(66.43)	(178.07)	413.69	(423.28)	1,114.60	1,048.01	(65.51)	(106.25)	555.49	(349.27)	1,552.87	1,667.30
Total Comprehensive Income for the period (comprising profit/(loss) for the period after tax and other comprehensive income after tax)	(61.44)	(166.78)	411.56	(408.32)	1,108.21	1,042.79	(60.54)	(94.92)	553.82	(334.35)	1,547.86	1,661.79
Paid up Equity Share Capital (Face Value of ₹ 1/- each)	2,221.73	2,221.73	2,221.73	2,221.73	2,221.73	2,221.73	2,221.73	2,221.73	2,221.73	2,221.73	2,221.73	2,221.73
Earnings Per Share (of ₹ 1/- each)												
-Basic & Diluted (Not annualised) (₹)	(0.03)	(0.08)	0.19	(0.19)	0.50	0.47	(0.03)	(0.05)	0.25	(0.16)	0.70	0.75

NOTES TO FINANCIAL RESULTS:

- The above unaudited financial results as reviewed by Audit Committee have been approved at the meeting of the Board of Directors held on 6th February, 2020. Limited review of the above results have been carried out by the Statutory Auditors of the Company.
- The consolidated results include the result of the company's associate Meghalaya Power Limited (MPL) in which the Company holds 48.80%.
- The Company has adopted Ind AS 116 'Leases' with effect from April 1, 2019, as notified by the Ministry of Corporate Affairs (MCA) in the Companies (Indian Accounting Standard) Amendment Rules, 2019 using modified retrospective method. Accordingly, the comparatives have not been retrospectively adjusted. The adoption of this standard did not have any material impact on the profit of the current quarter/nine months.
- The figures for the quarter ended 31 December 2019 are the balancing figures between the unaudited figures for the nine months ended 31 December 2019 and unaudited figures for the half year ended 30 September 2019.
- The company has elected to exercise the option permitted under section 115BAA of the Income Tax Act, 1961. Accordingly the company has re-measured its deferred tax assets/liabilities and will recognise tax provision as per the rates prescribed in the said section.
- There were no exceptional item during the quarter

એલચી, સીપીઓમાં ઘટાડો : કપાસ, કોટન, મેથા તેલમાં સુધારો : પ્રથમ સત્રમાં ૩.૧૯૦૧૭ કરોડનું ટર્નઓવર

મુંબઈ, તા.૬
વિવિધ કોમોડિટી વાયદા અને ઓપન-સમમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૨૯૯૯૧૫ સોંદરમાં ૩.૧૯૦૧૭ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. જેમાં કોમોડિટી વાયદાઓનો હિસ્સો ૩.૧૮૧૨૨૩૭ કરોડનો અને ઓપન-સનો હિસ્સો ૩.૮૨૫૧૮ કરોડનો રહ્યો હતો. કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં વૃદ્ધિ રહી હતી. સોનું ૩.૧૧૧ અને ચાંદી ૩.૪૮૨૯ વધ્યા હતા. એનર્જીમાં કૃત વેલમાં ૨.૩૧, ૭૬.૬૦૦ બેરેલના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં નરમાઈ હતી. નેચરલ ગેસ પણ ઠીકું હતું. કૃષિ કોમોડિટીઓ એલચી અને સીપીઓ ધટવા સામે કપાસ, કોટન અને મેથા તેલ સુધયું હતા.

૧૦ ગ્રામદીઠ ૩.૪૦૦૮૧ પૂલી, ઊપરમાં ૩.૪૦૩૮૭ અને નીચામાં ૩.૪૦૦૩૦ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રમાં અને ૩.૧૬૧૧૫ સોંદરમાં ૩.૪૦૩૬૧ બંધ રહ્યો હતો. ગોલ્ડ-મિની ફંજુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રમાં અને ૩.૭૮૮ વધીને ૮ ગ્રામદીઠ ૩.૪૦૩૨૩૭ અને ગોલ્ડ-મેટલ ફંજુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રમાં અને ૩.૮ વધીને ૧ ગ્રામદીઠ ૩.૪૦૦૨૯ વધ્યા હતા, જ્યારે સોનું-મિની માર્ચ વાયદો ૧૦ ગ્રામદીઠ ૩.૧૪૧ વધીને બંધમાં ૩.૪૦૨૨૭ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૩.૪૫૮૦૦ પૂલી, ઊપરમાં ૩.૪૬૨૩૩ અને નીચામાં ૩.૪૫૭૬૧ ના સત્રને સ્પર્શી પ્રથમ સત્રમાં અને ૩.૩૭૮ વધીને ૩.૪૬૧૭૪ બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફંજુઆરી ૩.૪૩૮ વધીને ૩.૪૬૧૯૨ અને ચાંદી-માઈક્રો ફંજુઆરી ૩.૪૪૮ વધીને ૩.૪૬૧૯૨ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ સોંદરમાં ૧.૭૫૬૦૮ ૩.૯૭૫૧.૫૮ કરોડનો ધંધો થયો હતો. કૃષિ તેલ ફંજુઆરી કોન્ટ્રેક્ટ બેરેલદીઠ ૩.૩૬૮૯૯ પૂલી, ઊપરમાં ૩.૩૭૧૯૯ અને નીચામાં ૩.૩૬૩૧૧ ધાવ્યાથી પ્રથમ સત્રમાં અને ૩.૩૭૪ થીને ૩.૩૬૪૩૦ બંધ રહ્યો હતો, જ્યારે નેચરલ ગેસ ફંજુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રમાં અને ૭૦ પેસા થીને બંધમાં ૩.૧૩૨.૩ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઓમાં ૩૮૨૬ સોંદરમાં કુલ ૩.૩૬૧.૧૪ કરોડનો કામકાજ થયો હતો. કોટન ફંજુઆરી વાયદો ગ્રાંસટીદીઠ ૩.૧૮૩૩૦ પૂલી, ઊપરમાં ૩.૧૯૪૧૦ અને નીચામાં ૩.૧૯૨૮૦ સુધી પ્રથમ સત્રમાં અને ૩.૪૦ વધીને ૩.૪૦૩૪૦ ના સત્રે બંધ રહ્યો હતો. સીપીઓ ફંજુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ ૩.૭૬૬.૩ પૂલી, પ્રથમ સત્રમાં અને ૧૦ પેસા થીને બંધમાં ૩.૭૬૩.૮ ના ભાવ હતા, જ્યારે એલચી ફંજુઆરી વાયદો કિલોદીઠ ૩.૩૬૦૦૦ પૂલી, અને ૩.૩૩.૩ થીને ૩.૩૫૭૫ થયો હતો. મેથા તેલ ફંજુઆરી વાયદો કિલોદીઠ ૩.૧૯૫.૨ પૂલી, ઊપરમાં ૩.૧૨૦૩.૫ અને નીચામાં ૩.૧૧૮૯.૯૨ થી, અને ૩.૧૯૫.૨ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ ૩.૧૦૭૦ પૂલી, ઊપરમાં ૩.૧૦૭૬.૫ અને નીચામાં ૩.૧૦૭૦ સુધી જઈ પ્રથમ સત્રમાં અને ૩.૩૦૦૦ વધીને ૩.૧૦૭૬.૫ ના સત્રે બંધ રહ્યો હતો.

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૧૬૪૮૮ સોંદરમાં કુલ ૩.૩૨૪૪.૨૩ કરોડ ની કીમતનાં ૨૦૯૬.૪૦૫ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૫૩૮૮૮ સોંદરમાં કુલ ૩.૨૦૦૨.૨૨ કરોડ ની કીમતનાં ૪૩૫૧.૧૪૮ ટોન, એલ્યુમિનિયમમાં ૫૬૪૭ સોંદરમાં ૩.૭૦૩૮ કરોડનાં ૫૧૬૪ ટન, તાંબામાં ૭૫૯૬ સોંદરમાં ૩.૯૨૪.૪૨ કરોડનાં ૨૨૭૨.૫ ટન, સીસામાં ૪૪૩૩ સોંદરમાં ૩.૧૧૧.૧૫ કરોડનાં ૭૬૪૦ ટન, નિકલમાં ૭૩૫૧ સોંદરમાં ૨.૧૪૨.૭૧ કરોડનાં ૧૨૧૮૯ ટન, જસ્ટમાં ૧૬૨૦૪ સોંદરમાં ૩.૪૮૩.૯૧ કરોડનાં ૨૭૯૬૨ ટન, કૃષિ તેલમાં ૧૩૪૬૨ સોંદરમાં ૩.૮૫૩૧.૮૭ કરોડનાં ૨૩૧૭૬૬૦૦ બેરેલ, નેચરલ ગેસમાં ૪૦૯૭૯ સોંદરમાં ૩.૧૨૧.૯૧ કરોડનાં ૯૦૯૯૨૫૦૦ એમએમબીટીયુ, કોટનમાં ૪૯૧ સોંદરમાં ૩.૩૮.૩૪ કરોડનાં ૧૯૭૫ ગ્રાંસટી, સીપીઓમાં ૨૮૬૬ સોંદરમાં ૩.૩૦૧.૦૪ કરોડનાં ૩૯૫૧૦ ટન, એલચીમાં ૧૯ સોંદરમાં ૩.૭૨.૨૦ લાખનાં ૨ ટન, મેથા તેલમાં ૩૩૯ સોંદરમાં ૩.૧૯.૨૦ કરોડનાં ૧૨.૮૩ કરોડનાં ૫૨૮ ટના વેપાર થયા હતા.

ઓપન ઈન્વેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૨૩૧૧૬.૧૭ કિલો, ચાંદીના વાયદાઓમાં ૩૮૪૮.૯૩ ટન, એલ્યુમિનિયમમાં ૫૨૨૦ ટન, તાંબામાં ૨૧૫૫૮ ટન, સીસામાં ૭૧૬૧ ટન, નિકલમાં ૩૨૬૫.૫ ટન, જસ્ટમાં ૨૧૦૮૧.૬૨ કરોડનાં ૪૨૮૦૦૦ બેરેલ, નેચરલ ગેસમાં ૫૬૧૬૨૫ એમએમબીટીયુ, કોટનમાં ૨૧૦૫૦ ગ્રાંસટી, સીપીઓમાં ૭૦૫૩૦ ટન, એલચીમાં ૯.૬ ટન, મેથા તેલમાં ૨૬૧.૭૨ ટન અને કપાસમાં ૮૬૮ ટના સત્રે રહ્યો હતો.

કોમોડિટી ઓપન-સમમાં કુલ ૩.૨૨૫.૧૮ કરોડનું ટર્નઓવર (નોશલ) થયું હતું. જ્યારે પ્રથમ સત્ર ૧૪.૪૬ કરોડનું રહ્યું હતું. ઓપન-સમના કુલ વોલ્યુમમાં કોલ ઓપન-સમનો હિસ્સો ૬૧.૫૭ ટકાનો ૩.૨૨૯.૫૨ રહી પ્રથમ સત્રમાં અને ૨.૫૭૮ બંધ રહ્યો હતો. ટાંબાનો ઓપન-સમ સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપન-સમનો ૩.૪૩૦૦૦ ની સ્ટ્રીક પ્રાઈસવાળો ફંજુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૩.૦૫૧૧ પૂલી, ઊપરમાં ૩.૪૨૮૨ અને નીચામાં ૩.૦૩૧ રહી પ્રથમ સત્રમાં અને ૩.૩૬૬ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપન-સમમાં ૩.૪૫૦૦૦ ની સ્ટ્રીક પ્રાઈસવાળો ફંજુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૩.૩૭૫ પૂલી, ઊપરમાં ૩.૩૭૫ અને નીચામાં ૩.૨૨૯.૫૨ રહી પ્રથમ સત્રમાં અને ૩.૨૫૮ બંધ રહ્યો હતો.

સેન્સેક્સ ૧૬૩ પોઇન્ટ ઊંઘી ૪૧૩૦૬ની સપાટી ઉપર નિકટની ૪૯ પોઇન્ટ સુધી સુધારો : કરોડારી આશાવાદી આઈસીઆઈસીઆઈ આન સ્પોટ હોમલોનની મંજૂરી આપશે

પોલિસી સમીક્ષા વચ્ચે પણ સેન્સેક્સમાં સુધારો નોંધાયો

આરબીઆઈ દ્વારા રેપોર્ટ અને અન્ય દરોમાં કોઈ ફેરફાર કરવામાં ન આવતા તેની અસર બજાર પર જોવા મળી

મુંબઈ, તા.૬
શેરબજારમાં આજે સતત ચોથા દિવસે તેજીનો માહોલ રહ્યો હતો. રિકવર બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રેપોર્ટ અને અન્ય દરોમાં કોઈ ફેરફાર કરવામાં ન આવતા તેની અસર પણ બજાર ઉપર રહી હતી. નાણાંકીય વર્ષ ૨૦૧૮-૨૦ની તેની છઠ્ઠી દિમાસિક નાણાકીય નીતિ સમીક્ષામાં તેનું વલણ આઈસીઆઈ દ્વારા સ્પષ્ટ કરવા બાદ શેરબજારમાં તેની ચર્ચા રહી હતી. આજે કરોડારી અને સેન્સેક્સ ૧૬૩ પોઇન્ટ ઊંઘીને ૪૧૩૦૬ની ઉંચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિકટની ૪૯ પોઇન્ટ ઊંઘીને ૧૨૧૩૦૬ની સપાટીએ રહ્યો હતો. એનએસઈમાં નિકટની ઈન્વેસ્ટ આજે ઉંચી સપાટી સાથે બંધ રહેતા કરોડારી આશાવાદી દેખાયા હતા. બેંક અને કાર્ડના સ્થિતિ



સર્વિસના શેરમાં ઉલ્લેખનીય સુધારો રહ્યો હતો. નિકટની બેંકમાં ૨૮૫ પોઇન્ટનો અથવા તો આશરે એક ટકાનો ઊંઘાનો રહેતા તેની સપાટી ૧૨૧૨૦૨ રહી હતી.

રહી હતી. ભારતી એરવેલ માર્કેટ મૂડીના મામલામાં ત્રણ ટ્રિબિયુનના આંકડા સુધી પહોંચી ગઈ છે. આજે આ ટ્રિબિયુન કંપનીના શેરમાં નવી ઉંચી સપાટી જોવા મળી હતી. કરોડારીના અને ૨.૫ ટકાનો ઊંઘાનો રહેતા તેની સપાટી ૫૪૭૨ રહી હતી. રી માર્કેટ ઓપરેટ કરનાર એવેન્યુ સુપર માર્કેટના શેરમાં પાંચ ટકાનો ઊંઘાનો જોવા મળ્યો હતો. વેલિક્ષ શેરબજારમાં પણ રિકવરી યથાવતરીને જારી રહી હતી. વોલસ્ટ્રીટ બેચમાર્કમાં રેકોર્ડ ઉંચી સપાટી રહી હતી. ચીન દ્વારા અમેરિકાથી આયાત કરવામાં આવતી કેટલીક ચીજવસ્તુઓ ઉપર ટેરિફમાં ઘટાડાની જાહેરાત કરી દીધી છે. કંપનીઓના પરિણામો હાલમાં જાહેર કરવામાં આવી રહ્યા છે જેને ભાગરૂપે એસીઆઈ, ઈન્ડિયા સિમેન્ટ અને એનટીપીસીના પરિણામ

સુધારા તેમજ એમએડ-કેમના પરિણામ શનિવારના દિવસે જાહેર કરાશે. શનિવારના વાયરસને લઈને દહેશત વિખાબરમાં દેખાઈ રહી છે તેની અસર ભારત ઉપર પણ થઈ છે. વિદેશી મૂડીરીકાણકોને જાન્યુઆરી મહિનામાં શેર માર્કેટમાં ૧૨૦૦૦ કરોડથી વધુ રકમ હાલવી દીધી છે. સતત પાંચમાં મહિનામાં ભારતીય ઈન્ડિયામાં સૌથી વધુ નાણાં ફાલવવામાં આવ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે બૌદ્ધિક તંગદિલી છળવી બની હોવા છતાં મૂડીરોકાણકો કેટલાક અમેરિકા દેખાઈ રહ્યા છે પરંતુ હજુ પણ કારોબારી જંગી નાણાં ફાલવી રહ્યા છે. ઈન્ડિયા સેગમેન્ટમાં એફપીઆઈ દ્વારા સરકારે મહિનામાં ૭૪૪૭.૮ કરોડ રૂપિયા કોલેક્ટ હતા જ્યારે અમેરિકાના મહિનામાં ૧૨૨૭૯.૯ કરોડ રોક્યા હતા.

સરકારના વિશ્વાસપાત્ર વર્તુળોએ એમ કહ્યું છે કે કેન્દ્ર સરકારને આ પ્રકારનો અધિકાર પા થઈ ગયા બાદ તે જરી લાગશે ત્યારે જ દરમિયાનગીરી કરીને વાંધાજનક દેખાતા ઈમ્પોર્ટ એક્સપોર્ટ પર પ્રતિબંધ મુકશે.

આનો ભાવ લેવા પ્રાકરોએ તેમનું પાનકાર્ડ, આધારકાર્ડ અને લોનની પુનઃ ચુકવણીનો ટ્રેક રેકોર્ડ/ એકાઉન્ટ સ્ટેટમેન્ટ લાવવાની જરૂર છે એમ આઈસીઆઈસીઆઈ દ્વારા કાર્ડના સેવા અને સીઈઓ અનિરુદ્ધ કામણીએ જણાવ્યું હતું.

ખરીદી કરતી વખતે ઝિલ લેવા માટે પ્રોત્સાહિત કરવા

ગ્રાહકો માટે જીએસટીનું બિલ જેકપોટ બનશે

૩.૧૦ લાખથી ૧ કરોડના ઈનામની યોજના

જીએસટી ઠેકાણના દરેક ઝિલ ગ્રાહકોને લોટરી જીતવાની તક પૂરી પાડશે



ન્યુ દિલ્હી, તા.૬
ગ્રાહકોને ખરીદી કરતી વખતે ઝિલ લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે સરકાર જીએસટી અંતર્ગત ૩.૧૦ લાખથી ૧ કરોડ સુધીની લોટરીની યોજના બંધ કરી રહી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સ્ટીમ્પેન્ડેડ ટેક્સ અને કરતમ (સીપીઆઈસીટી) ના સભ્ય જહોન જોસેફે જણાવ્યું હતું કે ગુડ્સ અને સર્વિસ ટેક્સ (જીએસટી) ઠેકાણના દરેક બિલ ગ્રાહકોને લોટરી જીતવાની તક પૂરી પાડશે અને તે ટેક્સ ચુકવવા માટે પ્રોત્સાહિત કરશે.

મારી પાસે રૂપિયા દસ લાખથી ઊંચે અને ૩ કરોડ કરતાં વધુની સંખ્યામાં ઝિલ લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે સરકાર જીએસટી અંતર્ગત ૩.૧૦ લાખથી ૧ કરોડ સુધીની લોટરીની યોજના બંધ કરી રહી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સ્ટીમ્પેન્ડેડ ટેક્સ અને કરતમ (સીપીઆઈસીટી) ના સભ્ય જહોન જોસેફે જણાવ્યું હતું કે ગુડ્સ અને સર્વિસ ટેક્સ (જીએસટી) ઠેકાણના દરેક બિલ ગ્રાહકોને લોટરી જીતવાની તક પૂરી પાડશે અને તે ટેક્સ ચુકવવા માટે પ્રોત્સાહિત કરશે.

એ. આ ઉપરાંત વકરતી, સીન અને રીમેરિટ ગુડ્સ પર સૌથી વધુ ટેક્સ રેટ ઉપરાંત સેસ પણ લેવાવામાં આવે છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામનની અધ્યક્ષતા હેઠળ રાજ્યના નાણાપ્રધાનોની બનેલી જીએસટી ક્રાઉન્સિલ પ્રસ્તાવિત લોટરી યોજનાની તપાસ કરશે. લોટરીની યોજના માટે પાન બનવા સિમિતમ કેટલી રકમનું ઝિલ લેવું જોઈએ એ પણ નક્કી કરવામાં આવશે. યોજના મુજબ ગ્રાહક ગ્રાહકોને લોટરી જીતવાની તક પૂરી પાડશે અને તે ટેક્સ ચુકવવા માટે પ્રોત્સાહિત કરશે.

સરકાર ગમે તે વસ્તુની આયાત-નિકાસ પર પ્રતિબંધ મૂકી શકશે

ન્યુ દિલ્હી, તા.૬
કેન્દ્ર સરકાર હવે કરતમ એક્ટ માં મોટાપાયે સુધારા વખાણ કરવા જઈ રહી છે અને આ સુધારા થકી તેને યુધ્ધી બધી સત્તા મળી જશે અને તે મુજબ હવે તે ગમે તે ચીજોના ઈમ્પોર્ટ એક્સપોર્ટ પર પ્રતિબંધ મૂકી શકશે. સ્વદેશી માર્કેટ અને અર્થતંત્રને નુકસાન કરતી હોય તેવી ચીજો ના ઈમ્પોર્ટ એક્સપોર્ટ પર પ્રતિબંધ મુકવાનો અધિકાર અત્યાર સુધી કેન્દ્ર સરકારને ન હતો અને કકત ગોલ્ડ અને સિલ્વર ના ઈમ્પોર્ટ એક્સપોર્ટ પર પ્રતિબંધ મુકવાનો જ તેને અધિકાર છે. કરતમ

એક્ટમાં સુધારા-વધારા થઈ ગયા બાદ કેન્દ્ર સરકારને ગમે તે ચીજોના ઈમ્પોર્ટ એક્સપોર્ટ પર પ્રતિબંધ મુકવાનો અધિકાર પ્રા થઈ જશે. સરકારના અંતરંગ વર્તુળોએ એવી માહિતી આપી છે કે કરતમ એક્ટ ૧૯૨૪ માં હવે સુધારા વખાણ કરવાની જરૂરિયાત દેખાય છે.

પાસ કરીને સસ્તા રમકડા અને જોખમી ફટકાડાઓ ચીનથી જંગી પ્રમાણમાં આયાત થાય છે અને તેનો રસ્તો બંધ કરવાનો સરકાર પ્રયાસ કરશે આમ કરવાથી વિદેશી માર્કેટને ઉત્તેજન મળશે અને સ્વદેશી ઉત્પાદન ને ફાયદો થશે.

સરકારના વિશ્વાસપાત્ર વર્તુળોએ એમ કહ્યું છે કે કેન્દ્ર સરકારને આ પ્રકારનો અધિકાર પા થઈ ગયા બાદ તે જરી લાગશે ત્યારે જ દરમિયાનગીરી કરીને વાંધાજનક દેખાતા ઈમ્પોર્ટ એક્સપોર્ટ પર પ્રતિબંધ મુકશે.

પીએમ મોદીએ કહ્યું કે જો એમ કોંગ્રેસમાં રસ્તા પર ચાલતા તો ૫૦ વર્ષ પછી પણ શત્રુ સંપત્તિ કાઢવી અટકી રહેતો. ૩૫ વર્ષ પછી પણ દેશમાં લડાઈ ચલવા પામી નહીં. ૨૦૧૮ વર્ષ પછી પણ સીડીએનની નિરખિત ન થાય તે સુધી નવા નવા